

આધાર સક્ષમ યુકવણી સિસ્ટમ (AePS) ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરવા માટેની અરજી

DBT Cust Consent Version 18072022

(9) હું બેન્કને એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ) લેણદેણ સેવાઓ માટે મારા અકાઉન્ટને (ઉપર મુદ્દા નં. ૮માં ઉલ્લેખ મુજબ) એનેબલ કરવા અધિકૃતિ આપું છું.

(10) મેં મારા આધાર નોંધણીકૃત મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપીનો ઉપયોગ કરવા માટે પોતાના ઈ-આધાર દસ્તાવેજ ડાઉનલોડ કર્યા છે.

(11) હું અત્રે એચડીએફસી બેન્કને લાગુ કાયદા હેઠળ આવશ્યકતા મુજબ અથવા ઉક્ત હેતુથી અથવા એચડીએફસી બેન્કની આંતરિક આવશ્યકતાઓ અનુસાર માહિતી અને ઓથેન્ટિકેશન ડેટા અને રેકૉર્ડ્સ જમા, જાહેર, આદાનપ્રદાન, સંગ્રહ, સંવર્ધન અને ઉપયોગ કરવા માટે અધિકૃતિ અને સંમતિ આપું છું.

(12) હું અત્રે ઘોષિત કરું છું કે મારા દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી બધી માહિતી સાચી, ખરી અને સંપૂર્ણ છે. જો આધાર બરોબર નહીં હોય અથવા મારા દ્વારા આપવામાં આવેલી કોઈ પણ માહિતી અચૂક નહીં હોય તો એચડીએફસી બેન્ક કે તેના કોઈ પણ અધિકારીને જવાબદાર નહીં ધરું.

તમારો કૃપાભિલાષી,

(આધાર નંબર ધારક સગીર હોય તે સંજોગામાં આધાર નંબર ધારક/વાલી કે પાલકની સહી અથવા અંગૂઠાની છાપ)

*એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) મેપિંગ: આ પ્રક્રિયામાં બેન્કનું નામ/ આઈઆઈએન અને ગ્રાહકનો આધાર નંબર એનપીસીઆઈ મેપરમાં અપડેટ કરવામાં આવે છે, જેથી ગ્રાહકના બેન્ક અકાઉન્ટમાં ડીબીટી/ સબસિડીઓ પ્રાપ્ત કરી શકાય.

**આઈઆઈએન (ઈજ્યુઅર આઈડેન્ટિફિકેશન નંબર) બેન્કને ઓળખવા માટે ઉપયોગ કરાય છે અને અગાઉની બેન્કની વિગતો, એટલે કે, "બેન્કનું નામ" ને આધારે ગ્રાહક પાસેથી સંમતિ અરજી પ્રાપ્ત કરતી બેન્ક દ્વારા અપડેટ કરાશે.